


એન રક્ષીલા શોઠ વર્ધમાન મનજીતી
પુત્રીના શ્રેયાર્થે બેટ.

“કુટલાંડ નહીં.”

ઉછરતી વયનાળાઓ ભરે હિતસિક્ષા-
આનો સંગ્રહ.

શ્રી જૈન ધર્મ પ્રસારક સભા
ભાવનગર.

1313



કુટલાંડ નાણી

નાણી રામદ છેડે લાવવા પૂર્વક અનેક
હિતશિક્ષાઓને સંખા.

ઉધરતી વયના બંધુઓને ખાસ ઉપયોગી જાણી
'સાહિત્ય' માસિકમાંથી ઉદ્ધરી સંકળના

પૂર્વક લખીને તૈયાર કરનાર

શા. કુંવરજી આણુંદજી.

છપાવી મસિદ્ધ કરનાર.

શ્રી જૈન ધર્મ પ્રસારક સભા.

ભાવનગર.

વિ. સં. ૧૯૮૦ ધ. સ. ૧૯૨૪

ધી "શારદાવિજ્ય" પ્રેસ—ભાવનગર.

અનુક્રમણીકા.

પ્રકરણ.	(એણારીના આંકમાંથી)	નિયમો	પૃષ્ઠ.
૧	જસવા જમાણવા સંબંધી.	૨૧	૧
૨	સુધારતા રવચ્છતા સંબંધી તથા ચાલવા સંબંધી.	૧૪	૪
૩	વ્યસનનિવારણ અને સસ્થયતાને લગતી કેટલીક બાબતો.	૧૦	૬
૪	કોઈના મકાનમાં જવા સંબંધી તેમજ ભીજુ પરચુરણ બાબતો.	૧૫	૮
૫	વાત કરવા સંબંધી.	૧૬	૧૦
૬	,, વિલાગ ભીજો.	૧૬	૧૩
૭	પરચુરણ શિખાભણો.	૧૪	૧૫
૮	ધરથી બહાર નીકલણી ચાલવા હુલવા વિગેરે અનેક બાબતાને લ-	૧૬	૧૮
૯	ગતી હિતશિક્ષા.	૧૬	૧૮
૧૦	ભીજલસમાં કે રેલવેમાં ઘેરેવા સંબંધી. ૬	૨૦	
૧૧	ભીજલસ વિગેરેમાં શાખવા થોડ્ય પર્તના સંબંધી.	૨૧	
૧૨	ચાલવા સંબંધી.	૧૨	૧૮
૧૩	પુત્રાદિક લખવા સંબંધી.	૧૫	૨૪
૧૪	સૌંદરીવિરોધાળી પરચુરણ શિખાભણો.	૧૩	૨૫
	અનુક્રમ હિતશિક્ષાઓ.	૬	૧૦

૩૫

૩૬

૩૭

૩૮

શ્રીધર્મજ્યન્ત પુસ્તકસંગ્રહ
વળા-(ડાદ્યાવાડ)

નામ—

પત્રાકાર નં:

ખાસ સૂચના.

ડોન્ટ નામની એક નાની પણ સુંદર યોગીને આપારે
સાહિત્ય માસિકના સને ૧૯૨૪ ફેઝુવારી ને માર્યના અંકમાં
ચ્યવનરાય શુક્લે ‘કેટલાંક નહીં’ એ ભાગાળાવાળો લેખ
વખેલો છે. તે વાચતાં ખુલ્હુ ઉપર્યુક્ત લાગવાથી કેટલાંક-સહજના
દેરક્કાર સાથે તે લેખ અમે તેમની પરવાનગી મેળવીને ખાસ
ખુદો છપાવવાનું યોગ્ય ખાલ્યું છે. આ લેખનો કેટલોક લાગ
તેના મૂળ લેખક (ચ્યવનરાય શુક્લ) ના જાતિ અતુભવ અને
અંગત અવલોકનને આભૂતી છે. ઈંગ્રેજ પદ્ધતિના અંગેને
છેવટનો લાગ મૂકી દીધે છે. પોતાને સસ્ય સમાજમાં ર-
હેનાર માનતી હેડ બ્યકિટ આમાંના ઘણાખસ નિયમોથી
અનાણ ન હોય, પરંતુ તેવા નિયમોને અહીં ઓફ્ટર ફરવા-
માં આવેલ છે તેનું ખાસ કારણ એ છે કે—કોઈ પણ નિ-
યમ ગમે તેટલો ઉત્તમ હોય છતાં સારો મુખલોકનકાર

કહી શકશે કે તેનું કેટલું ઉલ્લંઘન થાય છે ? જે એવા હાખજા અવિચાર કે બેપરવાઈને અંગેજ બનતા હશે, પણ તેમ બને નહીં તો હીક એવી ઉઠકટ આશાને અવલંખીને આ પ્રયત્ન કરવામાં આવ્યો છે.

કેટલાક ટીકાકાર બંધુઓ આ નિયમોના સંભળને હોદ અધ્યાપચુનું પ્રદર્શિન કહેશે, પરંતુ તેના ઉત્તરમાં સવિન્ય એટલુંજ કહેવાનું કે પોતાને કેમ વર્તવું ? કેટલી હુદ સુધી સભ્યતા બાળવવી ? અથવા છેવટ સભ્યતા કેને કહેવી ? તેને માટે હરેક વ્યક્તિ મુખત્યાર છે, સ્વતંત્ર છે, તેને છચ્છા પ્રમાણે વત્તવાની છુદ છે.

શિષ્ટાચારના સધાગા નિયમો આમાં સમાઈ ગયા છે એમ પણ માનવાનું નથી, રાખુકે ખુદ્દિની હુદ નથી. વિક્ષેપ ખુદ્દિવાનું આ કરતાં જુદા પણ અનેક નિયમો પ્રગત હોય શકે તેમ છે. તેવા પ્રકારનો પ્રયાસ થયેલો જોવાના છચ્છાક છીએ.

આશા સખીએ છીએ કે અમારો આ અદ્ય પ્રયાસ ઉછરતી વચના બંધુઓને અવશ્ય ઉપકારક થશે. એટલું કહીને આ દુંડી સૂચના સમાપ્ત કરવામાં આવેશું.

ચૈત્ર શુદ્ધ ૧
ચા. ૧૯૮૦

કુંપરણ આણંદજ
ભાવવનગર.



કેટલાક નહીં.

(ન કરવા ચોભ્ય કાર્ય વિગેરે અનેક બાબતો આમાં છે.)
(૧)

૧ જન્માં તમને જમવા માટે સોતરવામાં આંદ્યા હોય ત્યાં
પાછળ રહેતા નહીં. બરાબર વખતે છાજર થને જન્મની
તો તમને નોતરનારને તમે સુંભવણુમાં નાખશો, અન્ય
મહેમાનેને અકળાવશો, ને અત્તના અપરાધી બનશો,

૨ ઘરેપણ મેશાં જમવાના વખતનું ઉલંઘન કરશો નહીં,
એ ઉલંઘન કરશો સો, ઘરવાળાની કુસાંખી વધારશો,
તેમનો તમારાપરનો ભાવ ધારાડશો અને સુંસરસુંઘ-
માં રખલિત થશો.

૩ પંગતે જમવા બેસવાનો રીવાજ હોય ત્યાં સુંઘા પણ્યા
પછી વધારતા નહીં અને જમવાની આરા થયા અપૂર્ણ
૪ જમવા સાડતા નહીં.

૫ લાણુથી બેઠું દૂર કે તદ્દન અહીને બેસતા નહીં.

- ૫ જમતાં જમતાં બચકારા બોલાવતા નહીં
- ૬ જમતી વખત બહુ નીચા વળી જતા નહીં, ટટાર એસી-
ને જમજો.
- ૭ પુરી કે રોટલી હાથમાં લઈને તેના બચકા લરતા નહીં,
તેના કંકડા કરીને મોઢામાં મૂકજો.
- ૮ ઉતાવળા ને દ્વારા કરતા જમતાં નહીં, નિવૃત્તિએ જમજો
- ૯ મોટા મોટા કોળીઓ લેતા નહીં. પ્રમાણુસર લેને અને
તેમાંથી પાછું બાણુમાં પડે તેમ કરશો નહીં.
- ૧૦ તમારી સામે જમવા બેઠેલને તમારા જમવાની બોચા-
વાળવાની ટથ જોઈને સુગ આવે તેમ જમતાં નહીં.
- ૧૧ જમતી વખતે મોદું બહું પહોળું રાખતા નહીં.
- ૧૨ જમવામાં કોઈ વરતુમાં કાંકરી આવે તો શું શું કરીને
કાઢતા નહીં, તેને હાથમાં લઈને કોરે મૂકી દેને,
- ૧૩ મોદું ભરેલું હોય લારે બોલતા નહીં. બનતા સુધી
તો જમતાં જમતા બોલવાનું જ ઓછું રાખજો.
- ૧૪ કાંઈ પદાર્થ વડે મોદું છલોછલ ભરી દેતા નહીં. મોદું
ઘાડું ખાવામાં જ મળ છે, સ્વાદ સમબન્ધ છે; રસપડે
છે અને તંકુરસ્તી સંવાય છે.
- ૧૫ જમતી વખત કાળજી રાખને કે જેથી તમારાથી કાંઈ
દળી જાય નહીં, પડી જાય નહીં, પુટી જાય નહીં. કા-
ળજ રાખતાં છતાં કદ્દી તેમ બની જાય તો તેથી મુ-

આઈ જતા નહીં, અકળાઈ જતા નહીં અને બહુ હાથવરાળ કરતાં નહીં. તે વખતે સહેજ નિઃસ્પૃહી બનને અને બનેલું સુધારી દેબો. એને બહુ મહાવ આપશો નહીં.

૧૬. મહેમાનને જમાડતાં બહુ આચ્રહ કરતા નહીં. ખાસ કરીને તો આચ્રહની જરૂરજ નથી. એથી કાંઈ વહૃત વધી જતું નથી. અત્યાચ્રહ કરવાથી શરમાણ અતિથિને વધારે જમવું પડે છે. એવી રીતે આચ્રહ કરીને મહેમાનને મુંઝરદો એ અવિવેકીપદ્ધું છે.

૧૭. સારી સરલરા કર્યા બદલ, સ્વાહીષ રસોઈ બદલ સંતોષ બદલાયા શિવાય રહેતા નહીં, પણ તેમાં અતિચ્છેાઙ્ગિ ભરેલાં એટાં વખાણું કરશો નહીં.

૧૮. સામા માણુસને ત્યાં કોઈ જાતની પુરાણી રીતબાત ચાહતી હોય તો તે બદલ ટીકા કરતા નહીં, તમે તમારું ભાગવનો.

૧૯. રહેગી ચમકાથી કોઈ વરતુ ખાવાની હોય તો સંઘાનાને ખાને, ચમચો ખ્યાલામાં એવી રીતે મૂકૃતા નહીં કે ખાલો ગણડી પડે.

૨૦. હાથમાંથી કે મોઢામાંથી તમારા લુગડાપર કાંઈપદ્ધું પદાર્થ ખરે એવી રીતે ખાતા નહીં.

૨૧. બધા ખાઈ રહે નહીં ત્યાંસુધી શાખાપરથી ઉઠિતા નહીં.

(૪)

(૨)

- ૧ સુધડતાની અવગણના કરતા નહીં, તે જળવને, કારણ
કે સુધડતા સ્વચ્છતા નીતિનું એક અંગ છે.
- ૨ શરીરરૂપ સુષ્ટિની જીણું જીણું બાખતોમાં પણ એ-
પરવા રહેતા નહીં જુઓ ! કાળા નખ હોય તો પણ
શરમાવું પડે છે.
- ૩ નાકમાં અને કાનમાં વાળની વૃદ્ધિ થવા દેતા નહીં.
એ પણ જેનારને કંટાળો ઉપજાવે છે.
- ૪ જાહેરમાં કઢિ પણ નાક સાઝ કરતા નહીં, કાનનો મેલ
કાઢતા નહીં, મોં ધોતા નહીં, નખ લેતા નહીં. સુધ-
ડતા આવશ્યક છે પણ એ બધું ધરમાં થાય, જાહેર-
માં થાય નહીં. ખાનગીમાં થાય, રસ્તાપર થાય નહીં.
- ૫ ધોળાં પળી આવતાં હોય તો તેને કાળ દેખાડવા કલ્પ
ચડાવતા નહીં. એથી કાંઈ લોક છેતરાવાના નથી.
- ૬ હેર ઓદલ કે પેમોડનો ઉપયોગ કરતા નહીં. વચમાં
એનો વા બહુ વાયો હતો, પણ હું એ જંગલી મનોય
છે, અશિષ્ટ લેખાય છે, વળી એમાં સુધડતાનું નામે નથી..
- ૭ ચટાપટાવાળા રંગખેરંગી કપડા પહેરતા નહીં, અમે આ
હુકીકત મરહોને ઉદ્દેશીનેજ લખીએ છીએ. અલખેલા કં-
પડા પેરતા નહીં, એમાં શોકા નથી. લોકો તેવા કપડા
પહેરનારને ઉછંખત કહે છે.

- ૮ વિચિત્ર રાઈલના અને નવા કટના કપડા પહેરતા નહીં। એવા કપડા પહેરવાથી આખરું વધતી નથી, પણ ઘટે છે.. છાલકાપણું જણાઈ આવે છે, હલકાઈ દેખાઈ આવે છે. સામાન્ય પ્રકારના કપડા પહેરવામાંજ માન છે, મોખો છે. પહેરવેશ ધારીલો, ચોગ્ય અને અનુકૂળ હોવો જોઈએ, પણ એથી એમ સમજવાનું નથી કે તે શૃંગારી, રંગીલો ને અલખેલો જોઈએ.
- ૯ કાબરચીત્રા શર્ટ પહેરતા નહીં, જુલઝાવાળી કીનારી રાખતા નહીં, કાયમને માટે સફેદ ને સાદાં કપડાં પહેરવા તેજ ચોગ્ય છે.
- ૧૦ કોઈ બાખતમાં લાલાસાહેબ કેપુલખુળ બનતા નહીં।
- ૧૧ ધરમાં રહેવાના, ફરવા જવાના, સુવાના, જમવાના, દિશાએ જવાના કપડાં જુદા જુદા રાખને, બધી વખતનાં એકસરખા ને એકજ રાખતા નહીં।
- ૧૨ ચાલવામાં વિવેક રાખને. ધખડ ધખડ ચાલતા નહીં. સર્પાંકારે ચાલતા નહીં. ભીતે અથડાતા ચાલતા નહીં. જમીનપર ઠોકર મારતા ચાલતા નહીં. ધક્કા મારતા ચાલતા નહીં. સરલતાથી ચાલને. દાખપડ એવી રીતે ચાલને.
- ૧૩ ફ્રાંગ મારતા ચાલતા નહીં. ભુલતાપુલની જેમ ચાલતા નહીં. રૂઆખ પડે એવી રીતે ચાલને. એટો આ-

(१)

કાણર રાખશો નહીં.

૧૪ અસ્તિત્વામાં હૃદય ઘાલીને ચાલતા નહીં. બદ્દનના કાણુ-
માં અંગુઠો પરેં વીને ચાલતા નહીં. કાંઈ ચાવતા ચાવતા
ચાલતા નહીં.

(૩)

- ૧ તમાડુ ખાતા, પીતા કે સુંધતા નહીં. ‘પીએ તેનું મોડું,
ખાય તેનું ધર; સુંધે તેના લુગડા, એ ત્રણે બરાબર.’
સુધડમાં સુધડ વ્યસની પણ આ કહેવતમાં દર્શાવેલા
દ્વારથી સુકત રહી શકતો નથી.
- ૨ જે એ વ્યસનથી છુટી શકો તેમ ન હોય તો પણ શું-
કવા તથા ગળફા કાઢવાની બાબતમાં કાળજી રાખવી
ચુકતા નહીં. જહેર વાહુનમાં, સરીઆમ રસ્તામાં કે ખા-
નગી મીળકતોપર શુંકશો નહીં કે ગલફા કાઢશો નહીં.
- ૩ અનતા સુધી જ્યાં ત્યાં ગળફા કાઢતા નહીં તંદુરસ્ત
માણુસને તો ગળફા કાઢવાજ પડતા નથી. એ એક જા-
તની કુટેવનેજ આભારી છે. ગળાના કે ઈઝસાના દ-
રદથી પીડાતા માણુસને ગળફા કાઢવાની જરૂર પડે છે,
તો નેણે એ કિયા જહેર જગ્યામાં ન કરવી. લોચે, લીતે
કે ગમે ત્યાં મનસ્વી રીતે શુંકલું નહીં.
- ૪ શેરીમાં, વાહુનમાં, મેળામાં અગર અન્યત્ર જ્યાં અન્યન-
ને ત્રાસરૂપ થઈ પડે તેમ હોય ત્યાં મોટ સીસોટી વ-

આડતા નહીં ખરી રીતે તો મોઢે સીમોટી વગાડવીઃ એ
અસર્વતાજ છે.

૪ બધા વરચે ખી ખી હુસતા નહીં, પ્રસંગપર ચોઅય લાગે
તેટલુંજ હુસને. બહુ હુસવાથી એ હુસવું અંતાંક-
ખુનું સમજાતું નથી.

૫ સર્વત્રાને સર્વે પ્રસંગે હુસ્યા કરવાની ટેવ પાડતા નહીં
દિમત કે હાસ્ય થવું જોઇએ, પણ તે પ્રસંગાનુસાર પ્ર-
માણુમાં થવું જોઇએ, એની પણ હુદ હોય છે.

૬ ગમે ત્યાં વગરવિવિચારો હાસ્ય કરનાર માણુસ અઝ્કલથૂ-
ન્ય ગણ્યાય છે, તેથી એવી રીતે હુસવું નહીં. જેને તેને
દાંત દેખાડવા નહીં.

૭ બને ત્યાં સુધી એ સારા માણુસ બેઠા હોય તેમની એ-
ચે ઉધરસ કે છીક ખાતા નહીં. કેટલાએક મા-
ણુસને વારંવાર નાકમાં આંગળા ઘાલવાની ટેવ હોય
છે, પણ તે અસર્વ ગણ્યાય છે, તેથી ગજવામાં રૂમાદ
રાખવો અને તેના વડે નાક સાંક કરવું.

૮ બધા વરચે વારંવાર બગામાં પણ ખાવા નહીં, બહુ જુદી
જાસાં આવતા હોય તો બધા વરચેથી ઉઠી જવું અ-
થવા તેને રોકવાનો પ્રયોગ દમ ધુંટવો, શાસ રૂષ્ણવો,
વિગેરે કરવો કે જેથી તે બંધ થઈ જશે.

૧૦ શાસોધાસ મેં વાટે લેવો નહીં, નાકવાટે લેવો. ૮-

- શતાં પણ મોં બંધ રાખવાની ટેવ રાખવી, ઓલવાંવા-
સ્ટેજ મોં ઓલવું.
- ૧૧ વારંવાર મોઢે હાથ ફેરવવો નહીં, સુછો ભરડ્યા કર-
વી નહીં, પરીયા પંપાળ્યા કરવા નહીં અને હાથ
હલાંયા કરવા નહીં.
- ૧૨ કોઈને એકદમ દોડીને મળવું નહીં, તેમજ બહુ છેટા
પણ રહેવું નહીં.
- ૧૩ કોઈને ટપલા મારતા નહીં, ઘોડા મારતા નહીં કે ચુ-
ટીઓ ભરતા નહીં. પોતાને થતો આનંદ એવા રીતે
ખતાવવો તે ઘટિત નથી. આવી છુટ તમે કોઈની સા-
થે લેતા નહીં અને કોઈને તેવી છુટ આપતા નહીં.

- ૧ કહેવરાંયા વિના કોઈના ખાનગી ખંડમાં પ્રવેશ કરતા
નહીં. પોતાને ગમે તેટલો ગાઠ પરિયય હોય છતાં
પણ સામા ભાણુસના ગુસ અને એકાંતને માન આપ-
વાની આપણી કેરજ છે.
- ૨ પારકા ધરમાં જે બારણું ઉધાડું હોય તે દઈ હેતા નહીં
અને દીધેલું હોય તે ઉધાડું રાખતા નહીં. તેમ બારણું
ધડાધડ બંધ કરતા નહીં.
- ૩ કાપડની ફુકાનમાં, પુસ્તકાલયમાં, દાડખાનમાં, લાટ-
નાં પીડામાં, કોઈની ઓક્કીસુમાં કે થીએટરમાં બીજી

‘ પીતા નહીં.

- ૪ કોઈના મકાનમાં જાઓ લ્યાં કાગળ, ખત, દસ્તાવેજ,
હીસાબ અગર એવી કોઈ આનગી ચીજ પડી હોય
તો તેને હાથ અડાડતા નહીં.
- ૫ કોઈ માણુસ કાંઈ લખતું કે વાંચતું હોય તો તે તેની
પાછા છુપી રીતે ઉલા રહીને ડેકીયું કરી વાંચતા નહીં.
- ૬ કોઈની સાથે વાત કરતાં કે કોઈની વાત સંબંધિતાં ઝુ-
રશી મરડતા નહીં. એ એક જાતની કુટેવ ગણ્યાય છે
- ૭ ઝુરશીપર બેઠાયેઠા પગ પછાડતા નહીં.
- ૮ ઝુરશીપર, ટેબ્લેપર કે બારીપર આંગળીઓથી ટકેરા
મારતા નહીં, તાલ દેતા નહીં, ગાયનનો ગણ્યગણ્યાટ
કરતા નહીં. એવી ટેવો સંજનોમાં સારી ગણ્યતી નથી. |
- ૯ તમારા ઉપરી આગળ કંગાળ બનતા નહીં અને તાણેદાર
આગળ જાણીમ બનતા નહીં. આત્મમાન જળવણે,
આત્મપ્રતિષ્ઠા સત્યવણે, તેજ પ્રમાણે ખીજની લાગણી-
એને પણું માન આપતા શીખણે. એમનો દરજણે
જળવણે.
- ૧૦ કોઈ પણ ઠેકાણે એસી જવાની ઉતાવળ કરતા નહીં. ઉ-
લા રહેવામાં કાંઈ નાનમ નથી, નાય નથી, અયોધ્ય નથી
ઉલા ઉલા પણ વાતચીત સારીરીતે થધ શકે છે.
- ૧૧ હુખ્ખા, મીઠા અને અતડા થતા નહીં; તેથી વલુકુડા,

પુષ્પલુણ અને ખાંધલીઆ પણ થતા નહીં. હૃદયનું શાંત વતંનજ ઈચ્છિવા ચોય્ય છે.

- ૧૨ કોઈના મકાનમાં જાઓ લાં ઇર્નિંચર, ચિત્ર કે બીજી કોણ નવી લાગતી વસ્તુ ઉપર ટીકી ટીકીને જોયા કરતા નહીં, તેમજ અજણ્યા કે અણુઓળખીતા માણુસ સામે પણ તાક્યા કરતા નહીં.
- ૧૩ કોઈના ઘરમાં સોઝાપર કે આરામખુરશીપર લાંબા થઈને પડતા નહીં. એ પોતાના ઘરમાં જ ઢીક કર્યે તેમ છે.
- ૧૪ ખુરશીના પાછિવા એ પાચાપર આધાર રાખી આગલા એપાયા ઉંચા રાખીને એસતા નહીં શાંતિથી, વિવેકથી અને વિનયથી એસવાની ટેવ રાખલે.
- ૧૫ વારે ઘરીએ પગ ઉંચા નીચા કરતા નહીં. નણુકની વસ્તુ એને અજ્યા કરતા નહીં આંગળીએ રમાઝ્યા કરતા નહીં. સ્વસ્થ થઈને એસતાં શીખલે.

(૫)

- ૧ કોઈ પણ બાળતમાં હુંપદ રાખતા નહીં. કહું છે કે- ‘લઘુતાથી પ્રભુતા મળે, પ્રભુતાથી પ્રભુ હર.’ વિનયી બીજાના વિચાર કરવામાં એટલો મશાળુલ હોય છે કે તેને પોતાની જતનો વિચાર કરવાનો અવકાશજ મળતો નથી.
- ૨ જો તમને કોઈ ગાવા અજાવવાનું છે તો ખાસકારણ શિવાય ના પાડતા નહીં, એટા રીતે મેંધા થવાથી પતરા-

- ૧ અનું પ્રદર્શન થાય છે અને માન માગવાની ટેવ પડે છે.
- ૨ કોઈ ગાવા બળવવાની ના કહે તો તેને એ વારથી વધારે વાર આચ્છા કરતા નહીં. પહેલી વારની આનાકાની વિ-વેઠ કે શરમમાં ખપે, બીજીવાર ના પડી એટલે થઈ રહ્યું.
- ૩ વાત કરતાં કરતાં ખામા માણુસને અડકવું નહીં, હાથ જા-
લી હવાવવા નહીં કે ખલા જાલી ધુણાવવા નહીં; પ-
ડખામા આંગળી કરી ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરવો
નહીં. આવી કુટેવો અસભ્યતા સૂચવે છે.
- ૪ રસ્તામાં જતા આવતા માણુસો પણ સાંલળે એવી રીતે
બરાડા પાડીને વાત કરતા નહીં, અને વાત કરવાનો
તમારો એક વાનો જ ઈલારો છે એમ સમજુ રાખતા નહીં.
- ૫ સમુદ્ધાયમાં બેઠા હો તો બહુ વખત સુધી એક ને એક
જણની સાથે વાતો કર્યા કરતા નહીં.
- ૬ સમુદ્ધાયમાં બેઠા હો અને માત્ર એકજ જણુને કોઈ વાત
કરવી કે સંભળાવવી હોય તો તેના કાન કરડતા નહીં.
અનુકૂળ સમયની રાહ બેઈ બીજાને અપમાન ન લા-
ગે એમ વાત કરાલે.
- ૭ સમુદ્ધાયમાં પોતાની ને પોતાનીજ વાત કર્યો કરતા નહીં,
પોતાનાજ પરાક્રમ સંભળાયા કરતા નહીં, એમાં મા-
ન વધતું નથી, પણ બીજા અભિમાની માને છે, તેથી મા-
ન ઘટે છે.

- ૬ લોકપિય થવું હોય તો જેમ લોકને રસ પડે તેમ વાત કરને, તમને રસ પડે એમ વાત કરશો નહીં.
- ૭૦ પાંચ પચીશ માણુસ વચ્ચે બધા સમજે એવી વાત કરને; કોઈ એક એ જણાજ સમજે એવી વાતો કરતા નહીં, તેમ અમુક એક એ જણાજ હિતની વાત કરતા નહીં.
- ૭૧ ધણા માણુસ વચ્ચે પોતાનાજ રોદણા રહ્યા કરતા નહીં. પોતાનાજ વીતકડા વરણુંયા કરતા નહીં. પોતાનાજ હુઃખદ્વારંવાર સંલગ્નાંયા કરનાર માણુસ બીજા ઓને અકારો લાગે છે.
- ૭૨ લેળા થયેલા માણુસ જેને ન ઓળખતા હોય તેની વાત ઉપાડતા નહીં.
- ૭૩ કોઈની લાગણી ફુલવતા નહીં. કોઈની ઠેકડી મશકરી કરતા નહીં. કોઈના પર કટાક્ષ કરતા નહીં અને સલાહ સંપમાં ઝાટ પડે એવી કોઈ વાત કે એવું કામ કરતા નહીં.
- ૭૪ ઘોટા ગપગોળાની વાતો કરતા નહીં. ગપગોળા ઉડાવતા નહીં. કોઈની બદનક્ષી કરતા નહીં.
- ૭૫ કોઈનું અહિત ઈચ્છતા નહીં અને કોઈનું ખરાબ કરતા નહીં.
- ૭૬ સંશ્યાત્મક માણુસ સાથે વાદવિવાદમાં ઉત્તરતા નહીં, શંકાસપદ વાતો કરતા નહીં અને ચચોસપદ વિષયે ઉપાડતા નહીં.

(૬)

- ૧ મંડગમાં હાજર ન હોય તેવા માણુસની રૂપપ્રશંસા, વૈભવપ્રશંસા, વિજ્યપ્રશંસા, ગુણપ્રશંસા ગુણુદ્રાહી ખુદ્ધિથી કરવા ચો઱્ય છે, પણ જે તેથી હાજર રહેવામાં અસરોથ થાય તેવું હોય કે ઈર્ધા થાય તેમ હોય તો તે કરતા નહીં, કારણું કે ગુણુદ્રાહી મનુષ્યો અહુ અદ્વય હોય છે.
- ૨ કોઈ પણ ડેકાણે પોતામાં કોઈપણ પ્રકારની કુશળતા હોય તો તે બતાવવાનું ચૂકતા નહીં; પરંતુ તેમાં પ્રથમ ખીંચનો ને પછી પોતાનો વિચાર કરું કે ખીંચ કરતાં પોતાની કુશળતા વધે તેમ છે? જે વધે તેમ હોય તો જ બતાવવાનું કરેલે, નહીં તો ઉલટા હલકા પડશો.
- ૩ સામાન્ય જગતસામાં ધાર્મિક કે રાન્યદ્વારી વાતો શરૂ કરતા નહીં, કારણું કે એવી વાતો અનુન ઉપજાવે છે.
- ૪ વાતો કરે તેમાં જુહાણું આણુતા નહીં. જુઠી વાત કરતા નહીં. હુમેશાં સત્ય વક્તા ને રૂપી વક્તા બનાનો.
- ૫ જ્યાં છેતરપિંડો કે છળ પ્રાંપચ રમાતાં હોય ત્યાં દાખલ થશો નહીં! કેમકે ત્યાં અતિશયોક્તિ ને અસત્યનો ઉપયોગ થતો હોય છે અને અવિશ્વાસી વાતોવરણ અને હોય છે.
- ૬ કોઈ બોલતું હોય તો તેને બોલતાં અદૃકાવતા નહીં.

કોઈ વાત કરતું હોય તો વચ્ચમાં માથું મારતા નહીં.

૭ કોઈ જોલનારને તોડી પાડતા નહીં. જેમાં ને તેમાં વિ-
રુદ્ધ પડતા નહીં. પ્રમાણિક મતસેદમાં વાંધો નથી, પ-
રંતુ અવિચારી વિરોધ શિષ્ટપણાનું ઉદ્વંધન કરે છે.

૮ કોઈ વાતમાં જઝી થતા નહીં, વાગ્યુદ્ધ જગવતા નહીં,
એક મુદ્દો પણ્યો મૂકી ખોલ ઉપર ને ખીજથી ગોળ
ઉપર ઢોંયા જતા નહીં.

૯ કોઈપણ વાતનું લાંબું પીંજણું કરતા નહીં. એવી ટેવ
પાડતા નહીં! ટાયલાઝોર બનતા નહીં. જે વાત ક-
રવી હોય તે સરવતાથી, સ્પષ્ટતાથી અને સુધાસર
કુંકાણમાં કહેવાની ટેવ પાડને.

૧૦ કોઈનું માથું પડકનાર થતા નહીં. એકજ વાતને પડકી
રાખતા નહીં. સાંસળનારને જેમાં રસ ન પડે એવી વાત
ઓબાનતા નહીં. કોઈને કંટાળારૂપ બનતા નહીં.

૧૧ કોચરાની સાલની જરી પુરાણી વાતો કરતા નહીં. જેમાં
ને તેમાં મરકરી કરતા નહીં! પ્રસંગાતુસાર ટીંખળ
પણ લહેજતદાર નીવડે છે, પરંતુ વારંવાર ટીંખળ
કરનાર જંગલી લેખાય છે.

૧૨ જગલહેર થઈ ગયેલી—ચવાઈને કુચો થધ ગયેલી વાતો
કરવા એસતા નહીં, કારણું કે એવી વાર્તા સાંસળનારને
ચાસરૂપ થધ પડે છે.

૧૩ કોઈની ખાનગી કે અંગત વાત બધા વચ્ચે કરતા નહીં.

૧૪ તમને સારા શાલ્લોમાં સંયોધનારને થોડા અક્ષરમાંજ આએપી લેતા નહીં ; તેને સંતોષ થાય તેવા શાલ્લોથી ઉત્તર આપણો.

૧૫ કોઈની સાથે વાત કરતાં સભ્યતા ચૂકતા નહીં.

૧૬ કોઈ તમારી સાથે ખાસ વાત કરતું હોય ત્યારે ઐ-
દરકારી કે અધીરાઈ દાખવતા નહીં, કાન ધરેણે મૂર્કયા
હોય તેમ કરતા નહીં, દરેક જણું કહેવું વિવેકથી ચાં-
બળવું એ શિષ્ટ સમાજનું લખણ છે.

(૭)

૧ અહુંકાની બનતા નહીં પોતાની પ્રાપ્તિઓ કે પોતાની શ-
ક્ષયતાઓની મોટાઈ પોતાને મોઢ કરતા નહીં.
સુંપોતે શું શું કર્યું છે ને શું શું કરવાના છો તેના ધ્યાન
જેની તેની પાસે કરતા નહીં, પોતાની પ્રવીષૃતાની ધ-
યક્ષિઓ મારતા નહીં અને પોતાની વાતમાં પોતેજ ના-
યક બનતા નહીં.

૩ કોઈના છીર થોધવાની, કોઈની જોડ ખોળવાની, કોઈને
ઉતારી પાડવાની વૃત્તિ રાખતા નહીં.

૪ અવિવેકી પ્રશંસા કેમ ધૂલ્લા ઉપનાવે છે તેમ અવિદ્યારી
નિંદા, તીરસ્કાર કે કોઈ ઉપનાવે છે. દુનીયાદારી મા-
ણુસ તેજ કહેવાય કે જેનામાં સાસસાર સંમજવાની

શક્તિ હોય, લાલની ખંને બાળુ જોવાની ગમ હોય,
લાલાલાલ જણુવાની આવડત હોય અને ગુણુહોય પર-
ખવાની લાયકાત હોય.

૫ કોઈ વખત ઓકલા અટુલા પડી જાઓ તો નાઉમેદ
થછ જતા નહીં, હુઃપીયારા ખની જતા નહીં, તેવે વ-
ખતે ખીજને ખુશ કરવાના, સંતુષ્ટ કરવાના વિચાર
રાખો, પ્રયાસ કરો, જેથી તમે પણ ખુશી થશો અને
સંતુષ્ટ બનશો.

૬ તમને ઉપદ્રવ કરનાર પ્રત્યે પણ તિરસ્કાર દર્શાવતા નહીં.
સાચો સમજુ તેજ કહેવાય કે જે કહવી દવા જેવા અણુ
ગમતા પ્રસંગો પણ કટાણું મેઠાઢું કર્યા વિના ગળી જાય

૭ લખતી વખતે પેનસીલની અણી મોઢામાં ઘાલતા નહીં.
ચોપડીના પાના ફેરવતી વખત કે ગંગાપાના પતાં વ-
હેંચતી વખત આંગળી શુંકવાળી કરતા નહીં. ટપાલની
દીકીટ ચોડતી વખત પણ તેમાં જુલનો કે શુંકનો ઉ-
પયોગ કરતા નહીં. આવી કુટેવ ઘણુને પડેકી હોય
છે, પણ તે જરૂર તજવા ચોથ્ય છે.

૮ રમત રમતાં ખાળ હારી જાઓ તો ભીજાજ ખોતા નહીં.-

૯ વધેાવૃદ્ધ માણુસની વ્યાજળી માગણીને વધાવી દેવા
તું ભૂલતા નહીં. કેટલાએક જુવાનીઓઓ મોટેરાનું
(વૃદ્ધતું) માન જળવતા નથી, પરંતુ સાચો વિનય-અંતઃ-

કરણની ખરો કુમારો હુદ્દોની તાજેહારી વગર બાળ
ઉઠાવવામાંજ રહેલ છે.

- ૧૦ કોઈ માણસ ખાસ તમારી પાસે આવ્યું હોય ત્યારે
આપડી ઉધાડિને વાચવાને જોટો ડાળ કરતા નહીં;
આવનારનું આગમન નાપસંહ હોય તે રબલ દેને, અને
થવા દેને. અને તેમ ન હોય તો માણુસાઈ રાખનો,
આવનાર પ્રત્યે ફુર્દ્દ્ય ન કરતા, એપરવા ન બનતા.
- ૧૧ કોઈની એસવાની સારી જગ્યાએ તમે એસી જતા નહીં,
પારકી જગ્યા પચાવી પડતા નહીં.
- ૧૨ મેળામાં, જલસામાં, વાહનોમાં જતાં આવતાં શીંગ્યા
અને બાળકોને પહેલો માર્ગ દેને; એમની સગવ
સાચવને. નહીં તો તમે ઈન્સાન નથી પણ હેવાન છો;
માણુસ નથી પણ પણું છે. અને દેવ નથી પણ દાનવ છો.
ઓમ ગણુત્તી થશો.
- ૧૪ જ્યાં જાઓ ત્યાં શુંદરની ગાડે ચોટ્યા હો તેમ ચોંકી
રહેતા નહીં. તેમ જણે કોઈ પાછળ પકડવા આવ્યું
હોય તેમ ભાગ નાશ ખણું કરતા નહીં, વિવેકથી વિ-
ચારશો તો સમજશે કે ઘ્યાંસુધી એસવું ને છ્યારે
ચાલ્યા જવું.

(૬)

- ૧ ધરથી અહાર નીકળો. ત્યારે ખંનતા સ્ફુર્ધી ચોતાની ડાખી આણું ચાલનો. નહીંતો અથડાઅથડી થવાનો કંબન
રહેશે. જે પુરુષાય હોય તો તેની ઉપરજ ચાંસનો, નીચે
આલંતા નહીં.
- ૨ કોઈને ઠોકરમારતા નહીં. ધક્કા મારતા નહીં, કેટીને ચા-
લાત નહીં, તેમ અન્ય માણુસો પ્રત્યે બેદરકારી રાખ-
તા નહીં.
- ૩ તમારા અથડાવાથી કોઈ પડી જાય, કોઈનો પગ ચગ-
દાય કે કાંઈ અડયણું થાય તો તરત તેની મારી મારી
લેને; ભૂલતા નહીં.
- ૪ કોઈનું વિચિત્ર વર્તન કે નવીન પહેરવેશ જેણે હુસતા
નહીં.
- ૫ કોઈ માણુસ કે વસ્તુ સામે આંગળીઓ કરતા નહીં.
- ૬ ટોળામાં પેસતી વખત લાકડી કે છત્રી કોઈને વાગે
તેમ આડી રાખતા નહીં; તેમ રાખશો તો ગાળ
સાંભળવી પડશે.
- ૭ બીડી પીવાની ટેવજ પાડશો નહીં. કઢી ટેવ પડી ગઈ
હોય તો તે દ્વાર કરવા બનતો પ્રયાસ કરનો.
- ૮ બીડી પીવાની અનિવાર્ય ટેવજ હોય તેથી કઢી પીવી
પડે તો રસ્તા વરચે પીતા નહીં, કોઈની ઉપર ધુમાડો
કાઢતા નહીં અને વાહનમાં પીતા નહીં.

- ૧૩ રસ્તામર ગળાકું મોદામાંથી કાઢતા નહીં હે જેથી ખીંડ
ના ઘર બગડે.
- ૧૪ રસ્તે ખાતા ખાતા ચાલતા નહીં, ઓમાં ખરેખરી ખૂબ
ખર્ચ આપ્છે.
- ૧૫ અણમાં હે મંહિરમાં જલ આવવાનો રસ્તો શકીને ઉલા
રહેતા નહીં.
- ૧૬ રસ્તે ચાલતાં કોઈ ઓળખીતું માણુસ ભણે તો તેને
રસ્તા વરચે અટકાવી વાતે વળગતા નહીં. આજુ ખર
લઈ જઈને વાત કરનો.
- ૧૭ રેલ્વેના પ્લેટફોર્મ ઉપર એવી રીતે ઉલા રહેતા નહીં
કે જેથી અન્ય ઉત્તારુંઓને જતાં આવતાં હુક્કત પડે
- ૧૮ જે કોઈ પરિચિત માણુસ ભણે તેને પ્રથમ નમણ
કરવાનું-પ્રણામ કરવાનું અને પછી કુશળતા પૃથ્વીનું
શુવતા નહીં.
- ૧૯ કોઈ સ્વી સાથે વાત કરવી હોય તો તે રસ્તા વરચે
કરતા નહીં.
- ૨૦ જે કોઈ મણે તેને તમારી સાથેના માણુસનો પસ્તિયય-
ઓળખાણું આપવાની ઉતાવળ કરતા નહીં. એક પ્રી-
નાનું મન જણ્ણાય તોજ ઓળખાણું આપનો.
- ૨૧ અણણ્યા માણુસને વગર વિચાર્યા હુદ્ધપારના મસ્તે ઝુ-
છતા નહીં, આવી ટેવ સીજાતિને વિશેષ હોય છે, પણ
ત ચોગ્ય નથી.

૧૮ હથપારના પરગણું જનતા નહીં. એ બાખતમાં હોઈ-
કાર ન થનથું તેમ બહુ ચાવળાએ ન થતું.

૧૯ કોઈ ચાહ્યા જનરની વસ્તુ પડી જાય તો બ્યાજખી ને
પુરતા કારણ વગર એને હુાથ અડકાડતા નહીં, લઈ-
ને આપવા જતા નહીં. જે તે અપંગ કે અશક્તા હો-
ય તો તેને જરૂર મહદુદુ કરને.

(૬)

૧ બાહુનમાં કે ભીજલસમાં આગલી, સારી ને સગવડવાળી
જગ્યા મેળવવા માટે સલ્યતા ને છૂર કરી વિવેકને વિ-
સારી ફિદ હોડાહોડ કરતા નહીં. એવે પ્રસંગે પોતાને
સારી જગ્યા ન મળે તો બહેતર છે, પણ ગૃહસ્થાધને કોઈ
કીટે ગુમાવતા નહીં.

૨ પોતાને જેવાનું કે જાણવાનું લલે જતું રહે પણ સલ્ય-
તાને તો સહેજ પણ જવા દેશો નહીં.

૩ પોતાને જેઈએ તે કરતાં વધારે જગ્યા દણાવી એસતા નહીં.
એવી કીટે એસીને અન્યના હુક ઉપર કદિ ત્રાપ મારતા
નહીં.

૪ સ્ત્રીની જેમ પહોળા પગ રાખીને એસવાની ટેવ પાડતા
નહીં.

૫ ચીકારગાડીમાં એસવામાટે એસતા નહીં. કેટલીકવાર ખીજે
જગ્યા ન મળવાથી આ નિયમ જાળવી શકતો નથી,
પણ જે પુરતી તપાસ છરવામાં આવે છે તો ખીજે

જગયા મળી રહે છે.

૬ ચીકાર ગાડીમાં એસવાનો દુરાથ્રહ કરનાર ધુમણીઓને અટકાવવામાં પ્રથમ એઠેલાંઓ કાંઈ પણ એટું કરતા નથી; પરંતુ છતી જગયાએ એસવા આવનારને અટકાવવાની ટેવ પાડતા નહીં.

(૧૦)

૧ નાટક શરૂ થયું હોય, તમાસો ચાલતો હોય, ચ્યાખ્યાન ચાલી રહ્યું હોય તેવે વખતે વાતો કરીને કે ધમપછાડ કરીને ભીજના રંગમાં લંગ પાડતા નહીં.

૨ એવા પ્રસંગમાં વખતસર આવીને પોતાને ચોંચ જગયાએ એસી જવાનું ભૂલતા નહીં; અને શાંતિથી સાંભળવાનું પણ ચુકતા નહીં. આવા પ્રસંગમાં કાર્ય થઈ ગયા પછી વ્યવસ્થાપક જે કોઈને પણ આવવાની ટકાયતા કરે તો તે અચોંચ નથી.

૩ નાટકાદિ પ્રસંગોનો કાર્યક્રમ પૂરો થયા અગાઉ વરન્ને ઉઠીને ચાલ્યા જતા નહીં. એવા માણુસો ગૃહસ્થ ગણુંતા નથી.

૪ એવા પ્રસંગો વરચે તમારું ડહાપણ તોળી ભીજોએને જેવામાં કે સાસળવામાં અડાણું કરનારા બનતા નહીં. અફ્સોસની વાત છે ! કે જેએ મોટા મનાય છે, સર્વાંગણ્યાય છે, શિષ્ટ લેખાય છે એવા માણુસો પણ સામાન્યમાં સામાન્ય નિયમોનું ધણી વાર ઉદ્ઘાંધન કરે છે.

- ૫ કોઈ ખાખતમાં કંઈ પણ જેઠને કે સાંભળીને એકાંક્ષે
ગુણરાધ જતા નહીં, શાંત રહેને અને એ સદ્ગુણુમે-
ળવવા પ્રયાસ કરને.
- ૬ આન્યનું માન જાળવવામાં ગંડલત કરતા નહીં; કારણું કે
જેટલી આવશ્યકતા આત્મમાન જગ્નાનાની છે, તેટલીજ
તેની છે.
- ૭ શિષ્ટતા જગ્નાનાના કંટાળા ભર્યા પ્રયાસ કરતા નહીં.
શિષ્ટાચારનું પાલન થવું જેઠાં એ વાસ્તવિક છે,
પરંતુ એવો શિષ્ટાચાર પાળવાની પોતાની શક્તિ છે કે
નહીં? તેનો પ્રથમ વિચાર કરને.
- ૮ કોઈ વખત ભૂલ થઈ જાય તેની આડચણ નહીં; પણ
ભૂલો ન થવા માટે તમારી આતુરતા ઉધારી પડવા હે-
શો નહીં.

(૧૧)

- ૧ જોલવામાં અશુદ્ધ જોલતા નહીં. સારા લેખકના સારા જ-
ખાણા વાંચો અને તે વાંચીને તમારી ભાષા સુધારો.
- ૨ જોટા ઉચ્ચાર કરતા નહીં. શુદ્ધ ઉચ્ચાર જાણવામાટે કે-
ળવાયેલા માણુસની પાસે એસી તેમની વાતચિત્ત હ્યા-
નપૂર્વીક સાંભળો.
- ૩ ચીપી ચીપીને અથવા ગળગળીયા ખાતા હોકે ગણ-
રાતા હો તેમ જોલતા નહીં. વગર સંકોચે જોલને
અને કશાય આડંભર વિના જોલને.

- ૪ પછાડી સ્વરે હે તીણું અવાજે બોલતા નહીં, નાકમાં-
થી કે ગળામાંથી બોલતા નહીં, તેમ ઘાંટા પાડીને બો-
લતા નહીં.
- ૫ મનમાં દુઃખાતા હો તેવા સ્વરથી બોલતા નહીં. ધ્રીમેથી
બોલો. અને વજન પડે તેવી રીતે બોલો.
- ૬ મરડમાં બોલતા નહીં. જે કે કેટલીક વખત મરડમાં
બોલવાની જરૂર હોય છે, પણ જે તેને વાળતાં આવડતું
હોય તો જ તેમ બોલને.
- ૭ કોઈ પણ વખતે અમંગળ શાખદ બોલતા નહીં. તેમાં
પણ શુભ અવસરે તો તેવાં શાખદન બોલવાનું ખાસ ફૂલ-
નમાં રાખનો.
- ૮ વાતમાં એકને એક વાતનું પિષ્ટપેષણ કરતા નહીં,
અતિદાયેકિત કરતા નહીં અને વાસ્તવિકતા વિસરતા નહીં.
- ૯ વાત વાતમાં ‘બાપરે’ ‘હાય હાય’ ‘ઓ રામ’ એવા
શાખદો બોલતા નહીં.
- ૧૦ ‘જે છે તે’ ‘લણું કે ‘ભાઈને કહું’ ‘સંગયા’ એવા
એવા નકામા શાખદો બોલવાની ટેવ પડવા હેતા નહીં.
- ૧૧ ગાઢ પરિચય શિવાય કોઈને તોછડા નામે બોલાવતા
નહીં. કમળાખણે, રસિકભાઈ, એલા ખહુમાનથી બોલાવનો.
- ૧૨ કોઈ બ્યાકરણું દોષવાળું કે અશુદ્ધ ઉચ્ચારવાળું બોલે
તો તેને એકદમ હુલકો પાડી હેતા નહીં. જે તમારે
તેની ભૂલ સુધારવીજ હોય તો વિનયથી, મીઠાશથી,

ખીમેથી, એકાંતમાં તેની ભૂલો તેને સમજાવજો.

(૧૨)

- ૧ જરૂરી પત્રબ્યવહાર કાઈ ઉપર કરવા નહીં. અંક્ષિપ્ત સંદેશા પોસ્ટકાર્ડપર કરવામાં હરકત નથી, પણ આનગી લખાણું એવી રીતે કરવામાં નુકશાનનો સંભવ છે.
- ૨ પોસ્ટકાર્ડપર લખેલી હકીકતનો ઉત્તર મળવાની બહુઆશા રાખતા નહીં, કારણું કે એની મહત્વતા ઓછી ગણ્યાય છે.
- ૩ રહી કાગળપર ચીહ્ની લખતા નહીં.
- ૪ અમુક સંસ્થાના શિરનામાવાળા કાગળ આનગી ઉપયોગમાં લેતા નહીં.
- ૫ સુંહર સ્ટેશનરી વાપરવી એ ઉદારતા સૂચવે છે, તેથી હુલકી સ્ટેશનરી કે હુલકા નોટયેપર વાપરતા નહીં.
- ૬ કવલું ઉપર પોતાનું આણું અથવા ટુંકાશરી નામ, ગામ અને ડેકાણું છપાવેલું અથવા લખેલું હોવાનું ભૂલતા નહીં. એથી કેટલીક વખત બહુ લાલ થાય છે.
- ૭ કવર શુંકવડે ચોડતા નહીં. એમાં ઘણી જતના નુકશાન રહેલા છે.
- ૮ ચીપી ચીપીને આડંખરી ભાષામાં લખતા નહીં. એમાં રાઇર્ટિંગ માસ્ટરનું અનુકરણ કરશો નહીં.
- ૯ હૃદ્યાક્ષર સાઢા રૂપે સરલ ને નૈસાર્ગિક હોવા જોઈએ. તેને મરોડાર ખનાવવાનો એટો દંલ રાખતાં નહીં, તે-

- મજ ધુંટીને સાથ ખનાવવાનો ડોળ કરતા નહીં, તેમજ દહેંડામાં બધારે વાંકાચુંડા પણ લખતા નહીં.
- ૧૦ નિમંત્રણુની પહેંચ લખવી ભૂલતા નહીં. નિમંત્રણુ કણુલ રાખવું કે નહીં એ જુદી વાત છે, પણ પત્રનો પ્રત્યુત્તર તે આપવોજ જોઈએ.
- ૧૧ ડેઈના પત્રમાં લખાઈ આવેલા વિંષેક, વિનય, માયા, દ્યા, ઉપકારનો આસાર માનવાનું ભૂલતા નહીં.
- ૧૨ પત્રભ્રવહૃદારમાં ઉચિત વિશેષજ્ઞ નામની આગળ લખવાનું ભૂલતા નહીં. તેમજ ‘અ. સૌ.’ ‘ચી.’ ‘શ્રીચુત’ ‘મુરણ્ણી’ વિગેરે વિવેકના શાઢો વાપરવાનું પણ ભૂલતા નહીં
- ૧૩ જેનાપર કાગળ લખો તેના ઈંદ્રકાણ, પુદ્વી વિગેરે જાણીને તે શિસ્સનામામાં લખવાનું ચૂકતા નહીં.
- ૧૪ જેનાખુર પત્ર લખો તેને વાંચતાં પ્રેમ ઉપજે એમ લખવાનું ખાસ ધ્યાનમાં રાખજો, તે વાત ભૂદી જશો નહીં.
- (૧૩)
- ૧ પરાયા માણુસના હેઠતાં પોતાના ઉમરલાયક સંતાનને કે નેકરને પણ ધમકાવતા નહીં; કેમકે તેમને પણ સ્વમાન રહેલું છે.
- ૨ બનતા સુભી મેળાવડામાં નાના ખાળકેને લઈ જશો નહીં. મહેમાન સાથે તેમને બહુ મુટ લેવા દેશો નહીં.
- ૩ ખાળકેને અણુણ્ણા માણુસની લેળા જમવા ઐસવા

- હેશો નહીં, અને બાળકોને લોકોની નજરમાં લાખવાનો પ્રયાસ કરતો નહીં.
- ૪ તાથાના માણુસને સત્તાના અલિમાનથી આજા કરતા નહીં એમની લાગણીઓને પણ માન આપને.
- ૫ ઉપરી (ભાવીમ)નું જેર જ્યાં એલ્લા હોય છે ત્યાં નોકરો વધારે છદ્ગાગરા હોય છે. જે આજા વિચારીને કરે છે તેનું પાલન સહેંજ થાય છે.
- ૬ કુદુંખકલેશનું દ્વારાખ્યાન કરુની સંભળનારને કંઠાળો આપતા નહીં. તોકાની છોકરાએનું, ઉદ્ધત કુદુંખીએનું કે માથે ચડી બેઠકા નોકરોના દુઃખનું વણુંન જેની તેની પાસે કરતા નહીં.
- ૭ કોઈની અધરીઆ સંભળેલી વાતો બીજને કરતા નહીં. વાત વધારીને કરતા નહીં.
- ૮ તમારી મેળેજ કોઈના વિશે જૂડી અફ્વા ઉડાડતા નહીં, કોઈ અણુગમતાને હેઠળી નાકનું ટેરવું ચડાવતા નહીં.
- ૯ કોઈની મશકરી કરતા નહીં. સભ્ય થાઓ, હસમુખા થાઓ, કઠોર ન થાઓ અને તીખા મગજવાળા પણ ન થાઓ.
- ૧૦ જેને તેને ચીડવવાની ટેવ રાખતા નહીં. નાના બાળક, પણ પંખી, કુતરા બીલાડા વિગેરને નાહકના ચીડવવાની કેટલાકને ટેવ હોય છે, પણ એ માણુસના સ્વભાવતું છાલકાપણું ખતાવે છે; સભ્યતા ખતાવતું નથી.
- ૧૧ જ્યાં ત્યાં વિદુપક થતા નહીં. એમાં મોટાઈ નથી પણ

હુલકાઈ છે.

- ૧૨ પોતાના હરીએનું બુંડું બોલતા નહીં. પોતાના પ્રતિસ્પદીનું નાહકનું વગોણું કરતા નહીં. સામાવાળાઓનું પણ સાડું બોલવું એમાં સજજનતા છે.
- ૧૩ કોઈ અપરિચિત માણુસ વિષે માહિતી મેળવવી હોય તો તેની ડાખિલામાં બીજાને પૂછતા નહીં. એકાંતે પૂછીને માહિતી મેળવને

(૧૪)

- ૧ જો વાયકાસર પાછી આપી શકાય તેમ ન હોય તો કોઈની કાંઈ પણ ચીજ માગી લાવશો નહીં.
- ૨ મુદ્દતસર પાછી આપી શકો તેમ ન હોય તો કોઈની ચોપડી વાંચવા લાવતા નહીં, વાંચવા લાવેલી ચોપડી બગાડતા નહીં, કે બગડવા દેવા નહીં. એમાં ડાધા પાડતા નહીં.
- ૩ માગી લાવેલી ચોપડીના પાનાની કોર નિશાની રાખવા-માટે વાળતા નહીં. તેના માર્જનમાં કાંઈ લાખતા નહીં. સારા લાગતા વાકયો નીચે લીટીઓ હોરતા નહીં. ચિત્રો ફ્રાડી લેતા નહીં. પુઢા વાળી નાખતા નહીં. કુંકામાં કહેવાનું એજ કે લાવેલી બુઝનો સહૃપયોગ કરનો. દુર્ઘાત્માની પણ કરશો નહીં.
- ૪ કોઈ પણ વાળું અમુક સમયથી વધારે વાર વગાડતા નહીં. પાડેશીઓને તેનાવડે આનંદ આપવાને બહુવે

કંટાળો આપતા નહીં.

- ૬ દરેક મનુષ્ય શાંતિ ચાહે છે ને આરામ ઈચ્છે છે, તેથી તમારા ઘોંઘાટ કે લોંભાટથી તમારા પાડોશીઓને ન્રાસ-રૂપ થતા નહીં.
- ૭ કોઈ પણ વાળું વગાડવામાં પ્રવીષુતા મેળવ્યા શિવાય એમ તેમ વગાડ્યા કરતા નહીં. પ્રવીષુતા મળતા સુધી તમારા મનપર કાબુ રાખનો.
- ૮ કોઈપણ બાજુતમાં સ્વાર્થી થશો નહીં, એકલપેટા અનશો નહીં, જલિમ અનશો નહીં, મીળજ ઓનારા થશો નહીં, નિર્દ્દીય અનશો નહીં.
- ૯ સુહુજનનો બાખતમાં હુઃખમાં કુખો ગયેલાની જેવા હુઃખી, યારા અનશો નહીં. અણીયલ સ્વભાવના થશો નહીં, હૃઠીકા થશો નહીં. બડળણનારા થશો નહીં. ઉદ્દેગ કરશો નહીં. કકળાટીઆ થશો નહીં.
- ૧૦ કોઈને કહાપિ પણ ઉપાધિરૂપ થઈ પડશો નહીં. સર્જને પ્રિય લાગે તેવા થનો.

(૧૫)

(છોકરાઓને માટે)

- ૧ વિનયી થવામાં હુલકાશ હેણાય છે એહું ધારતા નહીં. નમતું મુકવામાં નાનમ જણ્ણાય છે એમ માનતા નહીં. નમનતાઈમાં લેશ પણ હીચકારાપણું લેખવતા નહીં
- ૨ હલ નીખાલસ રાખવાની ટેવ પાડનો. સૌને નીખાલસ દિલવાળા માણુસ ગમે છે, તેથી તેવી ટેવ પાડવાનું

ભૂલતા નહીં.

- ૩ સ્પેષ વક્તા થને, વીરત્વ યુક્ત થને. નીડર થને. તેમાં ભૂલ કરતા નહીં; પણ એટલું યાદ રાખને કે સ્પેષ વક્તાને અન્યની સહાનુભૂતિની અગત્ય છે. વીરત્વ સાથે ઉદારતાની અગત્ય છે. નીડર ને સાહસિક થાઓ, તે સાથે સાલસ અને સહૃદય અનને.
- ૪ સહાચારી થને. સહાચારી થવા માટે હુરાચારીની સંગત તજને, ભૂલેચૂકે એવાની સંગતમાં રહેશો નહીં.
- ૫ અજાણ્યા માણુસ પાસે ધાવકપણું ને ઠરેલપણું જળવને; કિંચિત્ પણ ઉછાંછળાપણું ખતાવશો નહીં.
- ૬ સદ્વર્તન રાખવું મુશ્કેલ છે એમ માનતા નહીં. સદ્વર્તન પણ સ્વાભાવિકજ છે અને તેમાં મળ છે. એ હુસવા બોલવાની જેવુંજ સરલ અને સહેલું છે, ઇકત તેની ટેવ પાડવી જોઈએ.
- ૭ સવારે ઉઠતી વખત અને સાંજે સુતી વખત મુરળ્યાઓને પ્રણામ અને બરોખરીઓને જ્યાજ્ય કહેવું ભૂલતા નહીં. નિશાળે જતાં અને ત્યાંથી આવતાં પણ એ ધોરણજ રાખને. નિશાળમાં શિક્ષકને પ્રણામ અને સહાધ્યાયીને જ્યાજ્ય કરવાના છે એ પણ ધ્યાનમાં રાખને. રસ્તામાં કોઈ મળે તો તેને પણ તેના દરજા મુખ્યે પ્રણામ કે જ્યાજ્ય કહેનો.
- ૮ ધરે મહેમાન હે કોઈ બીજું અભાણ્યું માણુસ આવે

- ने धरमां भीजुँ कोई वडील न होय तो तरत उठीने समां लेवा जले, अपर अंतर पूछले, आवधारुं आस-
ए जाण्ही लेजे अने बनती झडाय आपले. तेमां भूल करशो नहीं. भूल करशो तो अविवेकी गणुशो.
४. कोई वात खडु कुर्बायक अनी होय तो पछु तेने उमो-माह जखावशो नहीं. अंजीर अनी कुर्बाने पछु श्रवता शीघ्ले.
१०. भेटेरा वडीलो वातो करता होय तो तेमां पूळं सम-
ज्या विना तेमज कारण विना उष्टुं मारता नहीं.
कांध भोलता नहीं. कारणुके भेटानी वातमां जनाए
माशुं मारवुं नहीं, उष्टापचु डोणवुं नहीं, नाने भेटे
भोटा भोल भोलवा नहीं. आ प्रभाषे वर्तशो तो फाण्हा
ने शाण्हा कहेवाशो.
११. धरमां के धरनी बहार धांदा पाडीने भोलता नहीं. सा-
धारण स्वरे भोलवाथी ज्यां खोल सांलणीने समज
शक्ता होय त्यां ताणीने भोलवुं ए अविवेक गण्हाय
छे; अने एवी टेव पडया पछी जती नथी.
१२. आ खुक्ना प्रथमना लागमां जमवाने अंगे जे जे शि-
धामणे. आपेल छे ते खंधी ध्यानमां राखले. ए संभ-
धमां भीलकुल भूल करशो नहीं. लोजनमां ए प्रभाषे
शिष्टाचार पाणवानी जडूर छे. कोई तमने पूछे के-तमे
जेवा शिष्टाचारुं अर्थार्थ पालन करे. छे ? तमने

- સુધર્માથી, શાંતિથી, સરકારાથી ખુચરમીળને જમતાં
આપડે છે ! તેણું જવાબ દેરો ? તેનેં જવાબ ફરાખર
હેવાય એવા લૈયાર થને ને રહેણે.
- ૧૩ નિશાખમાં શિસ્કડ આથે માનથી વર્તને. સદ્ગ્રાહીઓ
આથે સલુકાધ્યથી વર્તને. અષ્ટાઙ્કમાં કાળજી સખને.
કેાઈને પજવશો નહીં કે ચીડવશો નહીં.
- ૧૪ તમારા નાના ભાઈખેનોને કે ભાઈબંધ હોસ્તદારોને
ખીજવશો નહીં, નહીં તો તમે તેને વહીબાસે જદ્વે
અકારા લાગશો.
- ૧૫ વૃદ્ધાની સેવા કરને, મુરખ્ખીઓનું માન રાખને, અજ-
ણ્યાને રસ્તો દેખાડને, એમાં ગુરુલત કરશો નહીં.
- ૧૬ કેાઈ ભાનભૂલાની પડી ગયેદી વસ્તુ હુથ આવે તો
જરા પણ લાલચમાં ન લગ્યાતાં તરતજ તેને પહેંચાડને,
એમાં ભૂલ કરશો નહીં.
- ૧૭ નિંઘ કામ કરશો નહીં, સત્ય છુપાવશો નહીં, વાત ઉડા-
વશો નહીં. દીઅર્થી બોલવાની ટેવ પાડશો નહીં. કેાઈ-
ને છેતરવા માટે દીઅર્થી બોલવું તે જૂદું બોલવા કરતાં
પણ અનિષ્ટ છે.
- ૧૮ સાચું કહેતા શરમાશો નહીં, અચકાશો નહીં, પ્રમાણિક
થને, મળતાવડા થને, નિખાલસ થને અને ખીજને
દાખલારૂપ ખનને.
- ૧૯ હુથ પગના નખમાં મેલ ભરામ તેમ કરતા નહીં. આતાઃ

(૩૧)

વિષિ બરાબર નિયમિત ને સંપૂર્ણ કરનો, દાંત બરાબર
સાડુ રાખનો, હાથ રક્ષા કે માટી લઇને બરાબર ધોનો,
નાક સાડુ રાખનો, મોદું બરાબર ધોનો.

૨૦ દરેક માણુસને સુધડ, સ્વચ્છ, સરલ, સાલસ ને સદ્ગાચારી
ખાળકોજ ગમે છે, તેથી તમે તેવા થવાનું ચૂકતા નહીં.

(૧૬)

[છોકરીઓને]

ઉપર જે કાંઈ છોકરાઓ માટે લખેલ છે તે બહેળે લાગે
છોકરીઓને પણ લાગુ પડે છે. ઉપરાંત વિશેષ નીચે પ્રમાણે.

- ૧ જમવા જમાડવાના શાધાચારમાં ભૂલ કરશો નહીં.
- ૨ પોતાના તાખાના માણુસો સાથે સલુકાઈથી વર્તવામાં
ચૂક કરશો નહીં, તેની સાથે અઘટતી છુટ લેશો નહીં.
- ૩ નોકરચાકરોને અણુઘટતા હુકમો ઉપરાઉપર કરતા
નહીં, તેમને કામ કરતાં અકળાવી દેશો નહીં.
- ૪ પોતાના વડીલો પ્રત્યે જેશરમ કે ઉદ્ધૃત વર્તનથી વર્તશો
નહીં. એવી રીતે વર્તનાર કેળવણી લીધેલ હોય છતો
મૂખ ગણ્ણાય છે.
- ૫ દાસ હાસીઓ પ્રત્યે નિર્દ્યપણે વર્તશો નહીં. આપણા
આશ્રિતોની લાગણીઓને પણ માન આપનો. એમનું
સુખ શોધવું તે સ્વામીતરીકે આપણી ક્રરજ છે એમ
સમજનો.
- ૬ છોકરાઓની જેમ તમે પણ પરસ્પર જયજય કે એવો

- ખીએ શ્રીતિકારક શાખા યોગવાની ટેવ પાડજે. તેમાં
ગફતત કરશો નહીં.
- ૭ તમારા નાના ભાઈ લાંડુ તમને ચીડવે, પણ કે ખીજ-
વે તો ચીડાતા નહીં, કારણ કે જે ચીડાવ છે તેનેજ
બાળકો વધારે ચીડવે છે.
- ૮ તમે તમારા નાના ભાઈ લાંડુને ચીડવશો નહીં, કે ખીજ-
વશો નહીં.
- ૯ સ્વાર્થી કે એકલપેટા બનશો નહીં, ખીલના સુખસ-
ગવડની કાળજી રાખવી એમાંજ અરી સહુકાઈ ગણ્ણાય છે.
- ૧૦ તાપવાના સગડી પાસે, ઝુરશીપર, કોચપર કે હીડિલા-
પર સારી જગ્યા મેળવવા માટે પડાપડી કરશો નહીં.
- ૧૧ ખીલ સાથે હોય ત્યારે તમારી બહેનગણી સાથેજ
વાત કર્યા કરતા નહીં. કોઈ વાંચતું હોય કે વાત કરતું
હોય તો તેમાં લંગાણુ પાડતા નહીં.
- ૧૨ માખુસોના રસુદાયમાં કોઈની સાથે ધુસુસ કરતા નહીં.
- ૧૩ તમે વાંચતા હો ને કોઈ જીમારી પાસે આવે તે ચો-
પડીમાં માથું ધાડી નહીં નહીં. તરતજ આવનારની
સામું જોજે ને આવ નારણ પૂછનો, તેમજ યોગજ
સતકાર કરનો.
- ૧૪ વલકુડી ખી જેવાં કપડાં પહેરતાં નહીં. સભ્યતા ને સુધ-
તાજ સર્વ સમાજમાં શોથી નીકળે છે.
- ૧૫ પગની આંટી મારીને કે પગપર પમ ચંદાનીને બેસવા

- નહીં. સારી ખીચોને એમ એસવું શોલા આપતું નથી.
- ૧૬ આંગળીના નખ દાંતવડે ઉતારતા નહીં. માથાના વાળ પંચાંજ્યા કરતા નહીં, તેમજ મોઢાપર હૃથ ફેરવ્યા કરતાં નહીં.
- ૧૭ મીઠા પદાર્થો બહુ ખાવાની ટેવ પાડશો નહીં. એમાં ખર્ચ સંણંધી ને શરીર સંબંધી ણાંને પ્રકારના તુકશાન રહેલા છે.
- ૧૮ મેળા કે મેળાવડામાં જાઓ. તો કોઈની સામું કે કોઈના વસ્ત્રાદંકાર સામું ટગર ટગર જોયા કરતા નહીં.
- ૧૯ કોઈ માણુસ તમારું કામ કરે કે તમને સહાય આપે તેનો આભાર માનવાનું ચૂકતા નહીં. તેમજ ઘનીશાકે લારે ખફલો વાળવાનું પણ ચૂકતા નહીં.
- ૨૦ કોઈ તમને ખોલાવે તેને મીઠા સ્વરથી જવાખ આપને, ખોલવામાં કોઈ પ્રકારનું ઉછ્છુખલપણું ખતાવશો નહીં.
- ૨૧ ગર્જના કરીને ખોલશો નહીં, તેમજ ગણુગણુતા પણ ખોલશો નહીં. ધીમો અને મૃહુ અવાજ એજ ખીચોનું ભૂષણ છે.
- ૨૨ કોઈનું લુંકું ખોલશો નહીં ને સહીયરોનું વગોણું કરશો નહીં.
- ૨૩ કોઈના સારાં કપડાં કે આલૂષણ હેખી જીવ બાળતા નહીં, અહેખાઈ કરતા નહીં, મીળજ ખોતા નહીં; કેમકે

કોઈની સર્વ અભિલાષાઓ પૂરી થતી નથી. આપણે જે કાંઈ ધર્મથી તે બધું આપણને મળતું નથી. માટે જે મજું હોય અથવા મળે તેમાં સંતોષ માનજો.

૨૪ અપશણદ મોદામાંથી કાઢતા નહીં. કુળવંતી નારીનાં મોદામાંથી અગંગળ શખદ કે અપશણદ નીકળતોજ નથી.

૨૫ માતા પિતા ને શિક્ષકની આજા પાળજો, સુસ્થાયો અને વડીલોનું માન રાખજો, સહીઓ સાથે રનેહથી વર્તજો, હાસદાસીઓ ઉપર દ્વારા રાખજો. ખીલની લાગણ્ણીઓનો વિચાર કરી તે ન હુઃખાય તેમ વર્તજો, વિનથી થજો, કપડાં લતાં રવચ્છ રાખજો, સુસ્ય સમાજના તમામ આચાર બરાખર પાળજો, તેમાં ભૂલ કરશો નહીં.

(૧૭)

(સીઓને)

- ૧ પોતકાને, સાઠીઓને, તેમજ ધાધરાઓને ઘણું કલ્પીએ ને કરચલીએ. કરાવતા નહીં. બહુ ઝગઝગતા કપડાં ખેદરતાં નહીં. આ રીવાજ હાલમાં બહુ વધી ગયેલો છે; પરંતુ સંસ્કૃત જનોની દૃષ્ટિમાં તે બહુ ઠીક લાગતો નથી. એમાં દેખાદેખીથીજ વધારો થયેલો છે.
- ૨ સાચું સૌંદર્ય સાદાઈમાં છે, તેમાં કૃત્રિમતા હોતીજ નથી તેથી કૃત્રિમતાવડે શોભાવાનું મનમાં ધારશો નહીં.
- ૩ ફેશનના હાસ બનતા નહીં, પહેલાં પોતાનું ઝપ તખતામાં

નેણે અને પછી અંતઃકરણની વૃત્તિએ પ્રમાણે વર્તને. દેશનથી રૂપમાં દેર કરતો નથી. માત્ર મનની એવી ઓટી માન્યતા થાય છે કે હું શોલુંધું.

૪ ઉંચી નીચી અથવા ગોરી કે કાળી સ્વીએ ભાડે કપડાં એક સરણા હોતાં નથી, તેથી શરીર સ્થિતિના પ્રમાણમાં વખ્તા પહેરને; તેથી જુદી સ્થિતિના વખ્તા પહેરીને શરીરની શોલા વધારવા છન્દશો નહીં

૫ ઘરમાં ગાલા જેવા કે ગંદા મસોતા જેવાં કપડાં પહેર વાતું રાખતા નહીં. એરી રીતે તો આપણે સારાં લુગડાં પહેરીને આપણા કુદુંબીએને ઝુશી કરવાના છે, તેને બનાવે તેની પાસે એવાં મસોતાં જેવાં લુગડાં પહેરવાં ને બહાર નીકળવું ત્યારે લખકો મારવો તે ઘટિત નથી, તેથી ઘરમાં પણ રવચ્છ અને શરીરને શોલે તેવાં કપડાં પહેરને.

૬ શરીરપર દાગીના ખડકશો નહીં. આંગળીમાં એક વીઠી, હાથમાં બાંગડીએ અને ગળામાં એક હાર એટલુંજ બસ છે. એથી વધારે ઘરેણા ઢાંસીને પહેરવાથી શરીરની શોલામાં વધારો થતો નથી.

૭ કાનમાં કે નાકમાં પણ માત્ર શોલે તેવાં નાનાં ધરેલું એરીંગ કે ચુની જેવુંજ પહેરને. લાંબા લટકતા ધરેલું પહેરશો નહીં.

- ૮ પગમાં આભૂષણું પહેરવાનો શોખ રાખશો નહીં, છતાં
રાખો તો પરો મેલ ન ચડના દેવાની શરતે રાખજો.
- ૯ હૃતામેતીના દાગીના આખો દિવસ પહેરી રાખતા નહીં,
એ વખતસરજુ પહેરેવા શોલે છે. તેને જળવતાં શીખજો.
- ૧૦ તમારામાં કુદરતી સૈંદર્ઘ્ય હોય તેટલુંજ ખસ છે. પા-
ઉડર વિગેરે બગાડીને સૈંદર્ઘ્ય વધારવાની ખોટી ચાહુના
કરશો નહીં.
- ૧૧ ચોખી ને તાજુ હુવા, નિયમિત આહાર, યોગ્ય કસ-
રત, કામ કરવાની રેવ, સ્નાન કરવામાં સુધરતા અને શ-
રીર શોલે તેવાં સાહાં વખ્ત એ ગાલ ઉપર સ્વાલાવિક
શુલાખી આણુશો, સૈંદર્ઘ્યમાં વધારે કરશો, તેથી તે બાખ-
તોને ખાસ લક્ષ્યમાં રાખજો, ભૂલી જરો નહીં.
- ૧૨ મીઠાઈ ખાવાની ખડુ ટેવ પાડશો નહીં. કેટલીક ઓ-
ઓ ખડુ ખાઉધરી હોય છે પણ તે પોતાના શરીરને
બગાડે છે, લંજણ છેડે છે અને એ કુટેવથી નીચે ઉત-
રી જવાય છે-લાલચું થવાય છે.
- ૧૩ જેની અલ વશ છે તેની પાસે અનિષ્ટ આવી શકતું નથી.
અનીતિ તેનાથી હુરની હુર રહે છે. અનેક અનિષ્ટનું
નિવારણ થાય છે. ખરી રીતે કહીએ તો અલજુ ઉન્મા-
ર્ગે લઈ જાય છે, તેથી તેને વશ થશો નહીં.
- ૧૪ કહી નવરાશ વધારે હોય, ધરમાં કામ કરનારા માણુસો

હોય તો પણ આપો દિવસ નોવેલ વાંચ્યા કરશો નહીં;
એમાં લાભ કરતાં ટોડો વધારે થાય છે. નોવેલની પ-
સંદર્ભી કરવામાં પણ ભૂવિ થાય છે, તેથી તેની યોગ્ય પ-
સંદર્ભી કરાવ્યા પછી વાંચજો. કારણુંકે સારો નવલકૃત્યા
આની સંઘ્યા આંગળીના વેઢાપર ગણ્યાય તેટલીજ છે.

૧૫ તમારાસંતાનને—છોડી છોકરાને કોઈના હેખતાં ખરચીઓ
કરતા નહીં યાંદ કરજો કે એવું વર્ત્ન તમારે માટે
હલકો વિચાર કરાવશો.

૧૬ ‘મારો વહીલ્ય’કે ‘મારી વહીલી’ એવા શષ્ઠ્યોનો ઉપ-
યોગ વારંવાર કરતા નહીં; કારણુંકે કેટલીક વખત ખાસ
અધ્યાત્મમશુનેજ વહીલા શષ્ઠ્યથી એલાવાય છે.

૧૭ કોઈને લાં મળવા ગયા હો તો ‘હવે જઈશુ’ ‘ઉદ્ધુંછુ હો’
એમ વારે વારે કહ્યા કરતા નહીં. ઉઠવું હોય તો તરત
ઉલા થજો, અને જવું હોય તો ચાલવા માંડજો, નહીં
તો એવું એટું એટું એલ્યા કરશો! નહીં.

૧૮ કોઈને મળીને ઘરે જતી વખત અથવા તમને મળીને
કોઈ જતું હોય લારે ‘જઉંછુ’ અને ‘આવલે’ વારે-
વારે કહ્યા કરતા નહીં, એક એવાર કહું એટલે બસ.

૧૯ રેખવે વિગેરેમાં એસવાની જગ્યા કરી આપનારનો અને
માણુસોની લીડમાં જઈને ટીકીટ લાવી આપનારનો ઉ-
પકાર માનવો ભૂલી જતા નહીં. ઉપકાર માનવારૂપ શ-

જ્ઞાનચારમાં એટલી ભીડાશ છે કે તે સાંભળવાથી ત-
મારે માટે પ્રયાસ લેનારનું ચિત્ત પ્રસત્ત થાય છે અને
દીધેલો પ્રયાસ કે જોગવેલી અગવડ ભૂલાઈ જાય છે.

૨૦ એસવામાં તમારે જેઠાએ તે કરતાં વધારે જગ્યા રોકૃત
નહીં, તમારો સામાન બીજાને અગવડ કરે તેમજો-
ઠવતા નહીં અને હાથમાં છત્રી રાખતા હોતો એવી
રીતે ઝેણવતા નહીં કે બીજાને ધળ કરે.

૨૧ ~~જાનુદુષાંધીની સાંભળી~~ તાડુકીને બોલતા નાં વિનાયી
વાણી ઝેણનેખલ કદી નહીં ગણ્યાય, તો પણ ચોખ-
સ્પદ તો ગણ્યાશે.

૨૨ ઘરમાં કંકાસપ્રિય બનતા નહીં. નિઃકુર કે મૂર્ખ ધણ્ણીને
પનારે પડેલી પણ શાંત રીતે સહન કરનાર ખી ધન્યવા-
દને પાત્ર ગણ્યાય છે; અને ધણ્ણી સામે તાડુકા કરનારી
ખી ચંડિકા કે વાધાણું ઉપનામ પામે છે. એવી
કંકાસીયણું ખીથો તો દેવતાને પણ લાગવું પડે છે.

૨૩ બહુ આડંબર કરવાની ટેવ રાખતા નહીં, ગંલીર થનો,
ઠાવકા થનો, હુસવા જેવું હોય ત્યારેજ હુસનો અને
ધણ્ણીને જ્હાલા થનો.

૨૪ સંતોષી થનો, ઉદાર થનો, અને પરદુઃખ નિવારણ
કરવાનો શક્તિના પ્રમાણુમાં ટેવ પાડનો. કંબુસ બનશો
નહીં, પણ કરકુસર કરનારં થનો.

૨૫ સદાચારી થજે. દરેક બાબતમાં સદાચારને આગળ કરવે,
એમ કરવાથીજ તમારી ગણુતરી સહયુધી ખીચોમાં થશે.

(૧૮)

(ધાર્મિક ઝરભાનો)

૧ સર્વ મનુષ્યોએ-ઓંચાએ-ખાગડોએ તેમજ ખાળિકાએ-
નીતિનું ઉદ્દેશ્યન ન કરવું. એમ બને તેમ વિશેષ નીતિ-
એ મુલ્ય રહેવું.

૨ નીતિ-સત્ય-પ્રમાણિક પણું-એ બધાં ધર્મના અંગ છે, અને

૩ મારંભના પગથીઓએ છે. - નિઃપ્રાયણ થયા વિના
તેના અંદરાનંદ નથી.

૪ મરી થણ્ણા લક્ષ્યા'ને 'આડી વ. શ્રી' રેણા શફ્ફોનો ઉપ

૫ કોઈપણ ઉલ્લને હુંઘ ઉપલબ્ધ, હુંઘ આપવું, શાર્દ્રાષ્ટ્ર
કૃષ હેવું, અથવા માણસ શય જેવી સ્થિતિમાં મૂકવો એ
બધા હિંસાનાજ પ્રકાર હે. અને તે ન કરવા એ અહિંસા
છે. અહિંસા કહો કે જીવદ્યા કહો તે સર્વ ધર્મનું મૂળ છે.

૬ સ્વીએ પરમુરૂપ સામું કે સુરૂષે પરસ્કી સામું જોટી બુદ્ધિ-
થી જેવું નહીં, તો પછી બીજી વાત તો શેનીજ હોય ?
આનો નીતિ ને ધર્મ બને સમાવેશ થાય છે.

૭ કોઈનું અણહુકે-અપ્ર. ડિક્ષણે છેતરને અથવા બીજ
રીતે કાંઈ પણ જેવું નહીં-એરી ન કરવી એ જોટી વાત
ગણ્યાય છે, પણ આ એક પ્રકારની ચોરીજ છે.

૮ સંતોષી થવું. દ્રવ્યની બહુ તૃપ્તા ન કરવી. અતિતૃપ્તા-
વાળાએ. દ્રવ્ય મેળવવા ખાતર અનીતિ કરવા તરમર થાય
છે, માટે સંતોષી રહેવું. સંતોષીને ભાગ્યાનુસાર દ્રવ્ય પ્રાસિ
થાયજ છે.

અનુભાવ

કિં બહુના !